

647510**0101225E1030****Seat No: _____****B.A. Semester - 2 (CBCS) Examination****March/April- 2018****ECONOMICS : P3 PRINCIPLES OF ECONOMICS-2
(ELECTIVE-1)****Time: 2:30 Hours****Marks: 70****Instructions:**

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

- પ્રશ્ન-૧ વૈકલ્પિક ખર્ચનો ખ્યાલ ઉદાહરણ દ્વારા સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૧ સરેરાશ ખર્ચ અને સીમાંત ખર્ચ વચ્ચેના આંતરસંબંધો આકૃતિ દ્વારા સ્પષ્ટ કરો.
- પ્રશ્ન-૨ ઘટતા મળતરનો નિયમ સમજાવો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૨ પેઢી વિકાસનાં લાભોની ચર્ચા કરો.
- પ્રશ્ન-૩ “બદલા કમાણી કરતા જે વધારાની આવક થાય છે તે ભાડું છે.” – આધુનિક ભાડાનાં સિદ્ધાંતનાં સંદર્ભમાં આ વિધાન તપાસો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૩ વહેંચણીનો સીમાંત ઉત્પાદકતાનો સિદ્ધાંત સમજાવો.
- પ્રશ્ન-૪ “નફો નવપ્રવર્તનનું પરિણામ છે.” – ચર્ચા કરો. (૧૪)
અથવા
- પ્રશ્ન-૪ “નફો જોખમ વહોરવાનું નહિ, પરંતુ અનિશ્ચિતતા વહોરવાનું વળતર છે.” – ચર્ચા કરો. (૧૪)
- પ્રશ્ન-૫ ટ્રેકનોંધ લખો: (કોઈપણ બે) (૧૪)
- (૧) સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ. (૨) ઉદ્યોગ વિકાસનાં લાભ.
- (૩) આભાસી ભાડું. (૪) ઘટતા મળતરનાં નિયમની ઉપયોગિતા.

English Version

- Que-1 Explain the concept of opportunity cost with the help of illustration. (14)
OR
- Que-1 Clarify the interrelationships between Average cost and marginal cost with the help by diagram.
- Que-2 Explain the law of Diminishing Returns. (14)
OR
- Que-2 Discuss the advantages of expansions size of firm.
- Que-3 "Rent is incurred if there is surplus over transfer earning" – Examine the statement with reference of modern theory of rent. (14)
OR
- Que-3 Explain the marginal productivity theory of distribution.
- Que-4 "Profit is a result of innovation" – Discuss. (14)
OR
- Que-4 "Profit is not reward for bearing of risks but reward for bearing of uncertainty" – Discuss.
- Que-5 Write a short note on. (any two) (14)
- (1) Fixed cost and variable cost.
 - (2) The advantages of expansion size of industry.
 - (3) Quasi-Rent.
 - (4) Usefulness of the law of diminishing return.
